

**Bank of Baroda**  
**Patān Main Branch- Hinglaj Chacher, Station Road, Patān, (Gujarat) - 384265** Phone: 02766-221221, 222347 Fax: 02766-222078, Email: patan@bankofbaroda.com

**POSSESSION NOTICE**

Whereas, the undersigned being the Authorized Officer of Bank of Baroda Patan Main Branch Distt- Patan under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 01.04.2021 calling upon the borrower **Mr.Narsinhbhai Dahyabhai Purohit (Loan A/c No.0148000026106)** and **Guarantor Smt.Jashbhai Narsinhbhai Purohit** to repay the amount mentioned in the notices aggregating **₹ 9,42,404.-** (Rs. 48,072.18:- reversal amount of interest after NPA) + interest w.e.f. 01.04.2021 and other charges thereas as mentioned in the notice within 60 days from the date of the notice.

The borrower / guarantors / mortgagors having failed to repay the amount, notice is hereby given to the borrower / guarantors / mortgagors and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property owned by **Mr. Narsinhbhai Dahyabhai Purohit** described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest Enforcement Rules 2002 and in exercise of the powers under Section 13(4) of the said Act on this 22nd June, 2021.

The borrower / guarantors / mortgagors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs. **9,42,404.-** (Rs. 48,072.18:- reversal amount of interest after NPA) + interest w.e.f. 01.04.2021 other charges thereas as mentioned in the notice.

The borrower's attention is invited to the provisions of sub-section (B) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

**Description of the Properties**  
 All that piece and parcel of residential building at Gram Panchayat Taluka, No.2107 Property serial No. 471 admeasuring in aggregate about 79.31 Sq. Mtrs. at Darbaras, VII-Junka, Taluka Hinglaj, Distt. Patan (North Gujarat) admeasuring 79.31 Sq. Mtrs owned by Mr. Narsinhbhai dahyabhai Purohit, Bounded as: East: Road, West: House of Babul Jethalal Joshi, North: House of Vaghela B.N., South: House of Purohit J.L.

Date : 22.06.2021  
 Place: Patan, Gujarat  
 Authorized Officer  
 Bank of Baroda

**DEEP INDUSTRIES LIMITED** (formerly known as Deep CH4 Ltd.)  
 CIN: L14292GJ2009PLC049371 REG. OFFICE : 12A & 14, ABHISHEE CORPORATE PARK, AMBLI BOPAL ROAD, AMBLI, AHMEDABAD - 380058  
 Ph.: 02717-298510 Fax: 02717-298520, E-mail: cs@deepindustries.com website: www.deepindustries.com

**STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31<sup>st</sup> MARCH, 2021** (Rs. In Lakhs)

Sr No	Particulars	Quarter ended		Year ended		Quarter ended		Consolidated		Year ended	
		31.03.2021	31.12.2020	31.03.2020	31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2020	31.03.2020	31.03.2021	31.03.2020
1	Total Income from Operations (net)	5173.95	4252.68	7370.50	17845.14	25113.85	6055.80	4529.31	8724.75	19370.55	26184.71
2	Net Profit/(Loss) for the period before tax and exceptional items	352.66	(799.49)	1068.20	(1173.88)	1441.87	403.38	(805.90)	3170.65	(1005.62)	2814.77
3	Net Profit/(Loss) for the period before tax (after exceptional items)	352.66	(799.49)	1068.20	(1173.88)	1441.87	403.38	(805.90)	3170.65	(1005.62)	2814.77
4	Net Profit/(Loss) for the period after tax (after exceptional items)	(185.33)	7667.94	(114.50)	6315.83	1737.24	(138.17)	7591.54	1875.38	6480.32	3100.14
5	Total Comprehensive Income for the period (Comprising profit/(Loss) for the period after tax) and other Comprehensive income (after tax)	(185.76)	7668.82	(115.64)	6316.28	1738.00	(138.60)	7562.42	1874.24	6480.78	3200.00
6	Equity share capital (Face Value of Rs. 10/- Per Share)	3200.00	3200.00	3200.00	3200.00	3200.00	3200.00	3200.00	3200.00	3200.00	3200.00
7	Other Equity										
8	Earning per share of Rs. 10/- each from Continuing and Discontinuing Operations)										
	Basic (in Rs.)	(0.58)	23.65	(0.36)	19.74	5.43	(0.43)	23.63	6.17	20.25	9.72
	Diluted (in Rs.)	(0.58)	23.65	(0.36)	19.74	5.43	(0.43)	23.63	6.17	20.25	9.72

Notes: The above is an extract of the detailed format of quarter and year ended financial results filed with the Stock Exchanges under Regulation 33 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the financial results for the quarter and year ended 31<sup>st</sup> March, 2021 are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and on the Company's website (http://www.deepindustries.com).

Place: Ahmedabad  
 Date: 24-06-2021

For, DEEP INDUSTRIES LIMITED  
 Sd/-  
 Paras Savla  
 Managing Director  
 (DIN: 00145639)

**Bank of Baroda**

**SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES**  
 "APPENDIX- IV-A [See proviso to Rule 6 (2) & 8 (6)]"

**E-Auction Sale Notice** for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorized Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" for recovery of below mentioned accounts. The details of Borrower/s/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/E-Auction date & Time, EMD and Bid Increase amount are mentioned below -

Sr/ Lot No.	Name & address of Borrowers / Guarantor/ Mortgage s	Give short description of the immovable property with known encumbrances, if any	Total Dues.	Date & Time of E- auction.	Reserve Price EMD and Bid Increase Amount.	Status of Possession	Property Inspection Date & Time.
1	Mr.Vinod Jivatram Motwani (borrower) and Mrs. Pooja Vinod Motwani (Co-Borrower) - Address: Flat No.406,04th Floor, Oasis Residency, Behind Prasang Party Plot,Opp.M.C Donald , Sama Savali Road, Vadodara -390022.	The Immovable Residential property /Flat belongs to Mr.Vinod Jivatram Motwani (Borrower) and Mrs.Pooja Vinod Motwani (Co-Borrower) being Flat No. 406, 04th Floor, OASIS RESIDENCY ,Behind Prasang Party Plot,Opp.M.C Donald,Near Canal, Sama Savali Road, Vadodara -390022.Having Built up Area 104.55 Sq.Mtr.As per sale deed. All that part and Parcel of the Property at Flat No.406, 04th Floor,Oasis Residency, R.S.No.354.356, T.P. Scheme No. 1, Vemali, Original Plot No.311/1 & 3/21,F.P.No.48,51, Moje Village,Sama,Vadodara District Vadodara Bounded as under: East: Flat No.405, West: FP NO.50, North:Passage& L.R., South:30.00 Mtr/Wide Road.	Rs. 25,83,975.22 (Rupees Twenty Five lakh Eighty Three thousand Nine Hundred Seventy Five and paise twenty two Only) plus interest and applicable charges as mentioned in demand notice minus recovery received after date of demand notice. Dated: 01.12.2018	15-07-2021 02:00 P.M to 06: P.M	30,20,000 3,20,000 2000	Physical	06-07-2021 11:00 A.M to 1:00 P.M

For detailed terms and conditions of sale, please refer to the link provided in https://www.bankofbaroda.in/e-auction.htm and https://ibapi.in. Also, prospective bidders may contact the authorized officer on Tel No. 0265 2336163, 2344551 M : 9152941081

Date : 25-06-2021 Place : Vadodara  
 Authorized Officer Bank of Baroda, R.C.Dutt Road Branch, Alkapuri, BARODA

**ESSAR SHIPPING LIMITED**  
 Regd. Office: EBTLSS Premises, ER-2 Building (Admin Building) Salaya, 44 KM, P.O. Box No.7, Taluka Khambalia, Devbhumi Dwarika, Gujarat - 361305  
 Email: esl.sectorial@essarshipping.co.in, Website: www.essar.com, CIN: L61200GJ2010PLC060285  
 Head Office: Essar House, 11, Keshavnagar Khadye Marg, Mahalaxmi, Mumbai - 400 034

**Statement of Standalone and Consolidated Audited Financial Results for the quarter and year ended 31 March, 2021** (₹ in Crore)

Sl. No.	Particulars	Standalone		Year Ended		Quarter Ended		Consolidated		Year Ended	
		31.03.2021	31.12.2020	31.03.2020	31.03.2021	31.03.2020	31.03.2021	31.03.2020	31.03.2020	31.03.2021	31.03.2020
1	Total income from operations	41.53	23.99	69.38	175.88	551.00	122.38	103.02	319.57	508.16	1,494.30
2	Net Loss for the period / year before tax, exceptional items and extraordinary items	(70.44)	(88.17)	(83.00)	(286.06)	(172.91)	(161.75)	(81.93)	(90.79)	(596.53)	(194.06)
3	Net Loss for the period / year before tax (after exceptional items and/or extraordinary items)	(70.44)	(88.17)	(2,862.42)	(297.27)	(2,952.33)	(176.56)	(1,81.93)	(1,545.19)	(619.94)	(1,685.74)
4	Net Loss for the period year after tax (after exceptional items and/or extraordinary items)	(70.60)	(88.22)	(2,862.63)	(297.89)	(2,953.44)	(176.72)	(1,81.98)	(1,545.40)	(620.56)	(1,686.85)
5	Total Comprehensive Loss net of tax	(70.27)	(88.36)	(2,861.81)	(297.69)	(2,950.53)	(176.53)	(1,81.81)	(1,538.82)	(620.66)	(1,683.94)
6	Paid-up equity share capital (Face value of ₹10/- each)	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98
7	Reserves (Excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)	-	-	(3,253.58)	(2,955.90)	-	-	-	(5,020.12)	(4,428.44)	-
8	Earnings per share before exceptional items (EPS)										
	(a) Basic (in ₹)	"(3.41)	"(4.26)	"(4.02)	(14.43)	(8.41)	"(7.82)	"(8.79)	"(2.67)	(28.85)	(9.43)
	(b) Diluted (in ₹)	"(3.41)	"(4.26)	"(4.02)	(14.43)	(8.41)	"(7.82)	"(8.79)	"(2.67)	(28.85)	(9.43)
9	Earnings per share after exceptional items (EPS)										
	(a) Basic (in ₹)	"(3.41)	"(4.26)	"(138.3)	(14.39)	(142.69)	"(8.54)	"(8.79)	"(74.38)	(29.98)	(81.5)
	(b) Diluted (in ₹)	"(3.41)	"(4.26)	"(138.3)	(14.39)	(142.69)	"(8.54)	"(8.79)	"(74.38)	(29.98)	(81.5)

Note: The above is an extract of the detailed format of Standalone & Consolidated Financial Result for the quarter and year ended 31 March, 2021 filed with stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and consolidated unaudited Financial Results for the quarter and year ended 31 March, 2021, are available on the website of the Company, www.essar.com and website of the Exchange (www.bseindia.com and www.nseindia.com)

Place: Mumbai  
 Date: 24 June, 2021

For Essar Shipping Limited  
 Sd/-  
 Capt. Subimal Mahato  
 Director

**IDFC FIRST BANK Limited**  
 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)  
 CIN : L85107GJ2014NPLC097792  
 Registered Office: KRM Towers, 8<sup>th</sup> Floor, Harrington Road, Chetpat, Chennai - 600031.  
 Tel: +91 44 4564 4000 | Fax : +91 44 4564 4002

**POSSESSION NOTICE (For immovable property)**

Whereas the undersigned being the authorized officer of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the Borrower/Co-borrowers and Guarantors to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

The Borrower/Co-borrowers/Guarantors having failed to repay the amount, notice is hereby given to the Borrower/Co-borrowers/Guarantors and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under sub-section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this 23-06-2021.

Loan Account Number	Borrower/s/ Co-borrowers/ & guarantors Name	Description of the Mortgaged Properties	Demand Notice Date & Amount Outstanding	Date And Type of Possession Taken
1184580	1. Rameshbhai Kakadiya, 2. Lalaben Rameshbhai Kakadiya.	All The Piece And Parcel Of The Property Consisting of 21, Somnath Park, Barejadi, Kankadiya.	13-07-2018 Rs. 31,57,911.73/-	23-05-2021 Physical Possession
1184847	1. Lalaben Rameshbhai Kakadiya, 2. Rameshbhai Kakadiya.	All The Piece And Parcel Of The Property Consisting of 20, Somnath Park, Barejadi, Nanodej, Kankadiya, Gujarat-380011.	20-07-2018 Rs. 31,60,009.43/-	23-05-2021 Physical Possession

The Borrower/Co-borrowers/Guarantors in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with property will be subject to the charge of IDFC First Bank Limited (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited) for an amount mentioned in the demand notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

Date : 23-06-2021  
 Place : Ahmedabad  
 Sd/-  
 Authorized Officer  
 IDFC First Bank Limited  
 (erstwhile Capital First Limited and amalgamated with IDFC Bank Limited)

**pnb** पंजाब नैशनल बैंक Punjab National Bank  
 Circle- SASTRA, 6th Floor, Gujarat Bhavan, Ellisbridge, Ahmedabad - 380006.  
 Ph. 079-26578602-03, 8511132732, Email:cs4517@pnb.co.in

**POSSESSION NOTICE Rule 8(1) (For immovable property)**

Whereas, the undersigned being the Authorized Officer of the Punjab National Bank under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (S.I. of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a below mentioned demand notice dated call upon the Borrower/Guarantor/Mortgagor to repay the amount mentioned in the notice within 60 days from the date of notice date of receipt of the said notice together with further interest and other charges from the date of demand notice till payment/realization.

The Borrower/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrower/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Sub-Section (4) of Section 13 of Act read with Rules of the Security Interest Enforcement Rules, 2002 on this 21st day of June of the year 2021.

The borrower/mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an amount and further interest and expenses thereon till full payment.

The Borrower's/Guarantor's/Mortgagor's attention is invited to provisions of Sub-Section (B) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Sr. No.	Name of Borrowers / Guarantors / Mortgagors	Demand Notice Date & Amount Outstanding	Description of the Properties
1.	Mrs. Dipikaben Hasmukhbhai Mehta & Mrs. Vaishali Ashwinkumar Mehta & Mr. Ashwinkumar Prabhulal Mehta (A/c No. 51940N00012858)	09.04.2021 Rs. 10,20,264.82	All that part and parcel of the property of Mrs. Dipikaben Hasmukhbhai Mehta consisting of Property situated at Flat No. 90-302 on Third Floor, Admeasuring 80 Sq.Yards (Super built up area), Block no. 90 in "Aagam-99 Residency Phase-II" in bearing Revenue Survey No. 1017/8 situated at Mouje/Village Sachana, Taluka - Viramgam and District-Ahmedabad, Sub-Registration District Viramgam. Bounded by: East: Flat no. 90-301, West: Road, North: Flat no. 90-303, South: Road
2.	Mrs. Dipikaben Hasmukhbhai Mehta & Mrs. Vaishali Ashwinkumar Mehta & Mr. Ashwinkumar Prabhulal Mehta (A/c No. 51940N00012867)	09.04.2021 Rs. 10,20,453.25	All that part and parcel of the property of Mrs. Dipikaben Hasmukhbhai Mehta consisting of Property situated at Flat No. 99-104 on First Floor, Admeasuring 80 Sq.Yards (Super built up area), Block no. 99 in "Aagam-99 Residency Phase-II" in bearing Revenue Survey No. 1017/8 situated at Mouje/Village Sachana, Taluka - Viramgam and District-Ahmedabad, Sub-Registration District Viramgam. Bounded by: East: Road, West : Flat no. 99-103, North: Road, South: Flat no. 99-101
3.	Mrs. Dipikaben Hasmukhbhai Mehta & Mrs. Vaishali Ashwinkumar Mehta & Mr. Ashwinkumar Prabhulal Mehta (A/c No. 51940N00012876)	09.04.2021 Rs. 10,23,495.84	All that part and parcel of the property of Mrs. Dipikaben Hasmukhbhai Mehta consisting of Property situated at Flat No. 90-303 on Third Floor, Admeasuring 80 Sq.Yards (Super built up area), Block no. 90 in "Aagam-99 Residency Phase-II" in bearing Revenue Survey No. 1017/8 situated at Mouje/Village Sachana, Taluka - Viramgam and District-Ahmedabad, Sub-Registration District Viramgam. Bounded by: East: Flat no. 90-304, West : Road, North: Road, South: Flat no. 90-302
4.	Mrs. Dipikaben Hasmukhbhai Mehta & Mrs. Vaishali Ashwinkumar Mehta & Mr. Ashwinkumar Prabhulal Mehta (A/c No. 51940N00012885)	09.04.2021 Rs. 10,24,222.87	All that part and parcel of the property of Mrs. Dipikaben Hasmukhbhai Mehta consisting of Property situated at Flat No. 99-102 on First Floor, Admeasuring 80 Sq.Yards (Super built up area), Block no. 99 in "Aagam-99 Residency Phase-II" in bearing Revenue Survey No. 1017/8 situated at Mouje/Village Sachana, Taluka - Viramgam and District-Ahmedabad, Sub-Registration District Viramgam. Bounded by: East: Flat no. 99-101, West : Road, North: Flat no. 99-103, South: Road
5.	Mrs. Dipikaben Hasmukhbhai Mehta & Mrs. Vaishali Ashwinkumar Mehta & Mr. Ashwinkumar Prabhulal Mehta (A/c No. 51940N00012894)	09.04.2021 Rs. 10,22,397.31	All that part and parcel of the property of Mrs. Dipikaben Hasmukhbhai Mehta consisting of Property situated at Flat No. 90-102 on First Floor, Admeasuring 80 Sq.Yards (Super built up area), Block no. 90 in "Aagam-99 Residency Phase-II" in bearing Revenue Survey No. 1017/8 situated at Mouje/Village Sachana, Taluka - Viramgam and District-Ahmedabad, Sub-Registration District Viramgam. Bounded by: East: Flat no. 90-101, West: Open Land, North: Flat no. 90-103, South: Road& Block-99

Date : 21-06-2021, Place : Ahmedabad  
 Authorized Officer, Punjab National Bank

**SHREE RAMA MULTI-TECH LIMITED**  
 Regd. Office : 301, Corporate House, Opp. Torrent House, Income Tax, Ahmedabad-380009  
 Website: www.srmt.com, Email : cslegal@srmt.com, CIN No. L25200GJ1993PLC020880

**STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON 31<sup>st</sup> MARCH, 2021** (Rs. In Lakhs)

Sr.No	Particulars	Quarter ended 31st March, 2021 (Audited)	Quarter ended 31st March, 2020 (Audited)	Year ended 31st March, 2021 (Audited)	Year ended 31st March, 2020 (Audited)
1	Total Revenue	3783.68	3023.19	13601.71	13099.65
2	Net Profit / (loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	18.37	116.53	343.30	537.15
3	Net Profit / (loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	18.37	(70.26)	343.30	1071.05
4	Net Profit / (loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)	18.37	911.95	343.30	2105.56
5	Total Comprehensive Income for the period [ Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	22.61	925.75	361.66	2123.82
6	Equity Share Capital (Face Value Rs.5/- each)	3176.03	3176.03	3176.03	3176.03
7	Reserves (excluding Revaluation Reserves) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	(349.76)	(711.42)
8	Earnings per Share (Basic & Diluted) (Face Value Rs.5/- each) (for continuing and discontinued operations)				
	1 Basic and Diluted EPS before Exceptional Items	0.03	1.73	0.54	2.48
	2 Basic and Diluted EPS after Exceptional Items	0.03	1.44	0.54	3.32

Notes:  
 a) The above Audited Financial Results have been reviewed by the Audit Committee and thereafter approved by the Board of Directors in their respective meetings held on 24th June, 2021. The audit as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the statutory auditors of the company and the related report is being submitted to the concerned stock exchanges.  
 b) The Audited Financial Results have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable.  
 c) The above is an extract of the detailed format of Audited Financial Results for Quarter and Year ended 31st March, 2021 filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Yearly Financial Results are available on the Stock Exchange website (www.bseindia.com and www.nseindia.com) and website of the company (www.srmt.com).

By Order of the Board of Directors  
 For, Shree Rama Multi-Tech Limited  
 Shailesh K. Desai  
 Managing Director

Place : Moti Bhojan  
 Date : June 24, 2021



